

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર/રિયલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ્સ (એનઈએફટી/આરટીજીએસ) આરબીએલ ખાતામાંથી ખાતામાં ટ્રાન્સફર (એટીએટી) માટે અરજી



તારીખ

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

પાન નં.

--	--	--	--	--	--	--	--	--	--

*આરબીએલ બેંકના ગ્રાહક દ્વારા પ્રદાન કરવામાં આવશે

પ્રતિ,
શાખા મેનેજર

.....શાખા

માનનીય સાહેબ,

કૃપા કરીને નીચે આપવામાં આવેલ વિગતો પ્રમાણે ફક્ત રૂ. (શબ્દોમાં રૂપિયા)

.....નીચેના એનઈએફટી/આરટીજીએસ/એટીએટી મારફતે મોકલી આપો:

☐ રોકડ ☐ ચેક ☐ મારું/અમારું ખાતું ડેબિટ કરો ☐ આરબીએલ ખાતામાંથી ખાતામાં ટ્રાન્સફર
(એટીએટી ગ્રાહક અને લાભાર્થીની વિગતો અંતર્ગત દર્શાવવામાં આવેલ ખાતા સંખ્યાના આધારે કરવામાં આવશે)

"રોકડના કિસ્સામાં, કૃપા કરીને પે-ઈન-સ્ટીપ કરો *અરજદારે કેપિટલ અક્ષરોમાં માહિતી ભરવી

અરજદારની વિગતો (મોકલનાર)	
બેંક ખાતા નંબર	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
ચેક નંબર (કૃપા કરી આરટીજીએસ માટે "આરબીએલ બેંક લિમિટેડ-આરટીજીએસ" અને એનઈએફટી માટે "આરબીએલ બેંક લિમિટેડ-એનઈએફટી"ની તરફથી ચેક લખો)	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
ચેકની તારીખ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
મોકલનારનું નામ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
સરનામું	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
મોબાઇલ/અન્ય નંબર	<table border="1" style="width: 100%; height: 20px;"></table>

બેનીફિસિયરીનું વિગત	
બેનીફિસિયરીનું નામ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
બેંક ખાતા નંબર	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
બેંક ખાતા નંબરની પુનઃ પૃષ્ઠિ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
બેંકનું નામ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
બેંક આઈએફએસસી કોડ (11-આંકડા)	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
બેંક શાખાનું નામ	<table border="1" style="width: 100%; height: 20px;"></table>
મોકલનારથી પ્રાપ્ત કરનારની માહિતી(જો હોય તો):.....	

નિયમો અને શરતો

• એકલ વ્યવહાર માટે આ ટ્રાન્સફર માન્ય છે. • તમામ ફંડ ટ્રાન્સફર સમયાંતરે બેંકની સંબંધિત શાખાઓ અથવા વેબસાઇટ (www.rblbank.com) પર દર્શાવવામાં આવેલ ક્લિયરિંગના સમય પ્રમાણે બેંક દ્વારા સુચનાઓ પ્રમાણે હાથ ધરવામાં આવશે. • લાભાર્થીના એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડની માહિતી ભરતી વખતે પૂરતી સાવચેતી દાખવો. • આ સુવિધાનો ઉપયોગ કરીને રૂપિયા 49,999 સુધીની રોકડ રકમ ટ્રાન્સફર કરવાની પરવાનગી છે. • ગ્રાહક સિવાયના દ્વારા..... થી વધારે રોકડ ચુકવણી માટે કોઈ ઓળખ આઈડીનો પૂરાવો આપવો જરૂરી બને છે. • કૃપા કરીને ખાતાની વિગતો/ઈન્ટરનેટ બેંકિંગ, યુઝર આઈડી અને પાસવર્ડ/એટીએમ ડેબિટ કાર્ડ/કેડિટ કાર્ડ/મોબાઇલ બેંકિંગ/વ્યક્તિગત માહિતી કોઈપણ વ્યક્તિ સમક્ષ જાહેર કરશો નહીં. • ખોટા વ્યવહારો શિકાર બનશે નહીં; શંકાસ્પદ યોજનાઓથી સાવધાન રહો. • આ ફંડ ટ્રાન્સફર વિનંતી-સંયુક્ત ફોર્મ ("નિર્દેશ") અંતર્ગત ઉલ્લેખ કરાયેલ તમામ માહિતીની ખરાઈ સુનિશ્ચિત કરવી તે ગ્રાહકની જવાબદારી છે. કેડિટ ફક્ત ખાતા નંબરની માહિતી પર આધારિત રહેશે. • ગ્રાહક દ્વારા રજૂ કરવામાં આવતી ખોટી/અધુરી માહિતીને લીધે સર્જાતા કોઈપણ પ્રકારના પરિણામો માટે બેંકની જવાબદારી રહેશે નહીં. • બેંક આરટીજીએસ/એનઈએફટી ટ્રાન્સફર માટે ચાર્જિસ અને/અથવા ફી ગ્રાહકના ખાતામાંથી ઉધાર કરશે.

ઘોષણા

• હું/અમે આરબીએલ બેંકના ઉપરોક્ત દર્શાવેલ માહિતી પ્રમાણે મારા ખાતામાંથી ડેબિટ એટલે કે ઉધાર કરી લાગુ ચાર્જિસ વસૂલ કરવા અધિકૃત કરું છું.
• હું/અમે સારી રીતે સમજ ધરાવ છીએ કે 14 ઓક્ટોબર 2010ના રોજ આરબીએલના પરિપત્ર પ્રમાણે ઇલેક્ટ્રોનિક મોડેલ માધ્યમથી ફંડ ટ્રાન્સફર ફક્ત આર્થિક વ્યવહાર શરૂ કરવાના સમયે રજૂ કરવામાં આવતા મેળવનારનું ખાતાની સંખ્યાના આધારે જ અમલી બનાવવામાં આવશે. નામને કેડિટ આપવાને લગતા માપદંડ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ગ્રાહકની સહી		
અરજદારની સહી (પ્રાથમિક અરજદાર)	અરજદાર 1ની સહી (સંયુક્ત અરજદાર 1)	અરજદાર 1ની સહી (સંયુક્ત અરજદાર 2)
નામ:	નામ:	નામ:
(ફક્ત બેંકના ઉપયોગ માટે) શાખાનો કોડ : <table border="1" style="width: 100%; height: 20px;"></table>	યુટીઆર નંબર: <table border="1" style="width: 100%; height: 20px;"></table>	
(નામ અને સહી) દ્વારા ઇનપુટ કરેલ ::.....		(નામ અને સહી) દ્વારા અધિકૃત કરેલ ::.....

ગ્રાહક સ્વીકૃતિ	
અરજી મળી છે આ માટે ☐ આરટીજીએસ ☐ એનઈએફટી ☐ આરબીએલ એટીએટી લાભાર્થીનું નામ	
ગ્રાહક આઈડી/ખાતા નંબર <table border="1" style="width: 100%; height: 20px;"></table>	☐ ચેક નંબર <table border="1" style="width: 100%; height: 20px;"></table>
રકમ (રૂપિયા) અને પૈસા.....)	
આ સાથે જમા કરવા ખાતા નંબર: <table border="1" style="width: 100%; height: 20px;"></table>	
યુટીઆર નંબર <table border="1" style="width: 100%; height: 20px;"></table>	
શાખા:..... તારીખ:..... બેંકના અધિકારીનું નામ અને સહી	

વિનંતીની તારીખ અને સમય સાથે બેંક સીલ

ગ્રાહક સેવા (24 x 7): +91 22 6232 7777; ટોલ ફ્રી નંબર: 1800 102 6222	અમને અહીં ઇમેલ મોકલો : customercare@rblbank.com વેબસાઇટ : www.rblbank.com
એસએમએસ બેંકિંગ વધુ માહિતી મેળવવા HELP ટાઈપ કરો અને 9223366333 પર મોકલી આપો	મોબાઇલ બેંકિંગ: મુલાકાત લો https://mobank.rblbank.com/ તમારા મોબાઇલ બ્રાઉઝર્સ
તમે વધારાની સુવિધા માટે આરબીએલ બેંક નેટબેંકિંગ ખાતે આરટીજીએસ/એનઈએફટીનો ઉપયોગ કરી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. વ્યક્તિગત નેટબેંકિંગ માટે ડેબિટ કાર્ડ અને પિનનો ઉપયોગ કરો.	